

# જ્યુઝ આંધ્ર ગાંધીનગર

NEWS OF GANDHINAGAR

(Daily)

દૈનિક

E mail - prdpraval@yahoo.co.uk

Editor : Pradip A. Raval (Mo) 98246 53073 a Block No.677/2, Gh Type, Sector - 8, Gandhinagar (Gujarat)

Volume : 10 a Issue No. 105 a Date: 06.02.2024 Tuesday aPage :04 aRs. 1.00/- aAnnual Rs. 351/-

## સપાના વડા અખિલેશ યાદવે કોંગ્રેસને ૧૧ સીટોની ઓફર કરી



લખનૌ,તા.૬  
ઉત્તર પ્રદેશમાં ભાજપ સાથે મુકાબલો કરવા માટે રચાયેલા વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની વહેંચણીની અંતિમ ફોર્મ્યુલા નક્કી થઈ નથી. સપાએ કોંગ્રેસ માટે ૧૧ બેઠકો નક્કી કરી છે, પરંતુ કોંગ્રેસે તેના પર મંજૂરીની મહોર મારી નથી. સપા અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીને લઈને અખિલેશ યાદવ સાથે કોંગ્રેસના નેતાઓની બેઠક થવાની છે, ત્યારબાદ અંતિમ સમજૂતી થઈ શકે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની ભાવિ રણનીતિ એ છે કે ગઠબંધનના સિદ્ધાંતને પરિપૂર્ણ કરવા માટે ભલે તેને ઓછી બેઠકો મળે, પરંતુ શરત એ છે કે તે સુરક્ષિત બેઠક હોવી જોઈએ જેથી ૨૦૨૪માં જીત નિશ્ચિત છે? સપા સાથે સીટની

વહેંચણી દરમિયાન કોંગ્રેસે અગાઉ ૩૦ સીટોનો દાવો કર્યો હતો. પછી મામલો ૨૩ પર આવ્યો. કોઈપણ ભોગે ચૂંટણી લડવા તલપાપડ બનેલા કોંગ્રેસના નેતાઓ હવે ૧૭થી ૧૮ બેઠકો પણ સ્વીકારવા તૈયાર છે, જ્યારે સપાના વડા અખિલેશ યાદવે કોંગ્રેસ માટે ૧૧ બેઠકો નક્કી કરી છે. કોંગ્રેસ માત્ર સપા દ્વારા સૂચવવામાં આવેલી બેઠકોની સંખ્યા પર જ નહીં, પરંતુ આપવામાં આવી રહેલી બેઠકોની સંખ્યા પર પણ સહમત નથી. કોંગ્રેસ તેના નેતાઓ માટે સુરક્ષિત બેઠકો મેળવવા માંગે છે, જેના માટે અભિયાથી ભદોલી, અમરોહા અને રામપુર સુધીની બેઠકો તેનું લક્ષ્ય છે. કોંગ્રેસે યુપીની સીટો પર ચૂંટણી લડવાની રણનીતિ બનાવી છે અને તે સીટો માટે

ઉમેદવારોના નામ પણ ફાઈનલ કરી લીધા છે. અભિયાથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય, ભદોલીથી રાજેશ મિશ્રા, રામપુરથી પૂર્વ સાંસદ બેગમ નુરબાનો, બારાબંકીથી કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ પીએલ પુનિયાના પુત્ર તનુજ પુનિયા, સુલતાનપુરથી પૂર્વ એમએલસી દીપક સિંહ, સહારનપુરથી પૂર્વ સાંસદ ઈમરાન મસૂદ, બહારાઈથી પૂર્વ સાંસદ. પૂર્વ સાંસદ કમલ કિશોર કમાનો માટે બસગાંવ સીટની માંગ છે. આ સિવાય ફતેહપુર સીટીથી રાજ ભબ્બરને અને મહારાજગંજથી રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસને બેઠકો આપતા પહેલા, સપાએ એ પણ પૂછ્યું હતું કે કોંગ્રેસ જે બેઠકોની માંગ

કરી રહી છે તેના પર સંભવિત ઉમેદવારો કોણ છે અને તેની જીતનો આધાર શું છે. તેના આધારે કોંગ્રેસે કેટલાક સીટ મુજબના ઉમેદવારોના નામ ભારત ગઠબંધન સાથે શેર કર્યા હતા. જ્યારે સપા સાથે કોંગ્રેસના નેતાઓની ચાર રાઉન્ડની બેઠકોનું કોઈ પરિણામ આવ્યું ન હતું, ત્યારે અખિલેશ યાદવે ૧૧ બેઠકો નક્કી કરી હતી. કોંગ્રેસ આ ફોર્મ્યુલા પર સહમત નથી, પરંતુ પાર્ટીએ મન બનાવી લીધું છે કે ગઠબંધનના સિદ્ધાંતને પરિપૂર્ણ કરવા માટે જો તેને ઓછી બેઠકોથી સંતોષ માનવો હોય તો તે તૈયાર છે, પરંતુ જીતી શકાય તેવી બેઠકોની જરૂર પડશે. આ સિવાય કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી લડવા માંગતા તેમના વરિષ્ઠ નેતાઓને એડજસ્ટ કરવામાં આવે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુશ્દેને ફરંબાબાદથી ટિકિટ જોઈએ છે. તેઓ કોંગ્રેસની એલાયન્સ કમિટીના સભ્ય પણ છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે

ત્યાંથી નવલ કિશોર શાક્યને ટિકિટ આપી છે. અખિલેશ નથી ઈચ્છતા કે સલમાન ખુશ્દેના કારણે કમોજ અને મૈનપુરીમાં તેમના સમીકરણો બગડે. તેમણે મૈનપુરીથી પત્ની ડિમ્પલ યાદવને ટિકિટ આપી છે. અખિલેશે પડોશી જિલ્લા ફરંબાબાદ અને એટાહમાંથી શાક્ય જાતિના નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે જેથી તેઓ યાદવ-મુસ્લિમ-શાક્ય સમીકરણ દ્વારા જીત નોંધાવી શકે. કોંગ્રેસ કોઈપણ ભોગે ફરંબાબાદ બેઠક ઈચ્છે છે. સપાના નેતા આઝમ ખાનને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવા અને જેલમાં રહેવાને કારણે, કોંગ્રેસ રામપુર લોકસભા બેઠક પર પોતાનો દાવો દાખવી રહી છે જ્યાંથી તે બે વખત સાંસદ બેગમ નુરબાનોને મેદાનમાં ઉતારવા માંગે છે. કોંગ્રેસ પોતાની જીતના આશા મુસ્લિમ સમીકરણ પર લગાવી રહી છે. એ જ રીતે, જ્યારે મ્હાંથી હાંકી કાઢવામાં આવેલા દાનિશ અલી અમરોહા બેઠક ઈચ્છે છે, જ્યારે ઈમરાન

મસૂદ માટે બિજનોર બેઠકની આશા રાખી રહ્યા છે. આ સિવાય કોંગ્રેસ મુરાદાબાદ સીટ માટે પણ ઈચ્છા વ્યક્ત કરી રહી છે, જ્યાંથી તે કોઈ મોટા મુસ્લિમ નેતાને મેદાનમાં ઉતારવા માંગે છે. આ વખતે કોંગ્રેસના યુપી અધ્યક્ષ અજય રાય વારાણસીને બદલે અભિયાથી ટિકિટ ઈચ્છે છે. અત્યાર સુધી તેઓ વારાણસીથી જ ચૂંટણી લડતા આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીથી લઈને મુરલી મનોહર જોશી સુધી

બધાની સામે લડ્યા, પણ જીત્યા નહીં. તેમને લાગે છે કે અભિયા તેમના માટે ભાગ્યશાળી હોઈ શકે છે, કારણ કે અભિયા સમાજવાદી પાર્ટીનો ગઠ રહ્યો છે. કોંગ્રેસે યાદવ-મુસ્લિમ સાથે ભૂમિહાર સમીકરણ બનાવવાની રણનીતિના સહારે આ બેઠક પર જીતનું સપનું પોષ્યું છે. અભિયા બેઠક પર કોંગ્રેસ માટે યાદવ-મુસ્લિમ-ભૂમિહાર સમીકરણ જીત્યું ગેરંટી બની શકે છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજેશ

મિશ્રા વારાણસીને બદલે ભદોલીથી નસીબ અજમાવવા માંગે છે. તે વારાણસીનો રહેવાસી છે અને ૨૦૨૪માં અહીંથી જીત્યો હતો. ભદોલી બેઠક પર બ્રાહ્મણ, મુસ્લિમ અને યાદવ મતોના સમીકરણના આધારે રાજેશ મિશ્રાને ફરીથી સંસદમાં પહોંચવાની તક મળી શકે છે. તેનું કારણ એ પણ છે કે આ વખતે સપાએ વારાણસી સીટ પર ચૂંટણી મેદાનમાં ઉતરવાની રણનીતિ બનાવી છે.

## થરાદના કાસવી કેનાલ-૨માં ૨૫ ફૂટનું ગાબડું પડ્યું, ખેતરોમાં પાણી ભરાયા

પાલનપુર,તા.૫  
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. થરાદની તાલુકામાં કાસવી માયનોર કેનાલ-૨માં ગાબડું પડવાના સમાચાર સામે આવ્યા છે. કેનાલમાં ૨૫ ફૂટનું ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો છે, તો ખેડૂતોએ પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. થરાદના કાસવી માયનોર કેનાલ-૨ માં ગાબડું પડ્યું છે. કેનાલમાં લગભગ ૨૫ ફૂટનું લાંબું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડવાની ઘટનાને લઈ હજારો લીટર પાણીનો વેડફાટ થવા લાગ્યો છે. ગાબડું પડવાને લઈ કેનાલની બાજુમાં રહેલા ખેતરમાં પાણી ભરાઈ જવાને લઈ ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પાકમાં મોટું નુકસાન થવાને લઈ મુસીબતમાં મુકાડું પડ્યું છે. કેનાલની બાજુમાં રહેલા ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા જરૂર, રાયડો, ઘઉંના ઉભા પાકને નુકશાન થયું છે. વારંવાર ગાબડા પડવાને લઈ કેનાલની ગુણવત્તાને લઈ આશ્ચર્ય થવા લાગ્યા છે.

## બિહારમાં નીતીશ કુમારની મુશ્કેલીઓ વધી, માંઝીની માર્ગ-નિર્માણ વિભાગની જુદ

હિન્દુસ્તાન આવામ મોર્ચાના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી (લેફ્ટ ઈન્ડિયન સ્ટેટ્સ)એ બિહારમાં નીતીશ કુમાર (રિફાઈઝર ટ્રેજર ડેવલોપર્સ)ની નવી સરકારની મુશ્કેલી વધારી છે. તેઓ મંત્રાલયની વહેંચણી અંગે નારાજ થયા છે. માંઝીએ જાહેર મંચ પર કહ્યું કે, અમને (જેઓ) મોટું મંત્રાલય કેમ આપાતું નથી. જ્યારે હું મંત્રી હતો, ત્યારે પણ એસટી-એસટી મંત્રાલય આપ્યું હતું. હવે મારા પુત્ર સંતોષને પણ આ જ વિભાગ સોંપાયો છે. તેમણે નીતીશ પાસે માર્ગ-નિર્માણ વિભાગ માંગ્યો છે. નીતીશ કુમારે ઈન્ડિયા ગઠબંધન સાથે છેડે ફાડી ૨૮ જાન્યુઆરીએ ભાજપ સાથે નવી સરકાર બનાવી હતી. નીતીશકુમાર ૮મી વખત મુખ્યમંત્રી બન્યા. ભાજપ ક્વોટામાંથી સમ્રાજ ચૌધરી અને

વિજય કુમાર સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવવાયા હતા. પાંચ અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. હમ ક્વોટામાંથી સંતોષ સુમને પણ મંત્રી બનાવવાયા હતા. મંત્રાલયની વહેંચણી વખતે નીતીશ કુમારે ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું. આ ઉપરાંત સામાન્ય વહીવટ, કેબિનેટ સચિવાલય, દેખરેખ, ચૂંટણી અને આવા તમામ વિભાગો પોતાની પાસે રાખ્યા છે. સમ્રાટને ફાઈનાન્સ, કોમર્શિયલ ટેક્સ, શહેરી વિકાસ અને આવાસ, આરોગ્ય, રમતગમત, પંચાયતી રાજ, ઉદ્યોગ, પશુ અને મત્સ્ય સંસાધન, કાયદો વિભાગ જ્યારે વિજય સિન્હાને કૃષિ, માર્ગ બાંધકામ, મહેસૂલ અને જમીન સુધારણા, શેરડી ઉદ્યોગ, ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્ર, શ્રમ વિભાગ મળ્યો. સંસાધનો, કલા, સંસ્કૃતિ અને યુવા, લઘુ જળ



સંસાધન, જાહેર આરોગ્ય ઈજનેરી વિભાગ ફાળવવાયા છે. નીતીશની સરકારમાં જીતનરામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમને (જેહલ્ જર ડેવલોપર્સ)ને માહિતી ટેકનોલોજી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ વિભાગ સોંપાયો છે. અગાઉ જ્યારે સંતોષ મહાગઠબંધનની સરકારમાં મંત્રી બન્યા હતા, ત્યારે પણ તેમને એસસી-એસટી

કલ્યાણ મંત્રાલય સોંપાયું હતું. આ ઉપરાંત જ્યારે જીતનરામ માંઝી બિહાર સરકારમાં મંત્રી હતા, ત્યારે પણ તેમની પાસે આ જ મંત્રાલયની જવાબદારી સોંપાઈ હતી.

## સુપ્રીમ કોર્ટ વિધાનસભા અધ્યક્ષના નિર્ણય વિરુદ્ધ ઠાકરે જૂથની અરજીને સૂચિબદ્ધ કરવા સંમત

નવીદિલ્હી,તા.૫  
સુપ્રીમ કોર્ટે સોમવારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અરજીને સૂચિબદ્ધ કરવા પર વિચારણા કરવા સંમત થયા છે. ઠાકરેએ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નારવેકરના 'અસલ શિવસેના'ના નિર્ણયને પડકાર્યો છે. હકીકતમાં, નારવેકરે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની છાવણીમાં રહેલી શિવસેનાને 'અસલ શિવસેના' ગણાવી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે ઠાકરે પક્ષ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલની રજૂઆતની નોંધ લીધી હતી કે અરજી, જે સોમવારે સૂચિબદ્ધ થવાની હતી, તે

સુનાવણી માટે સૂચિબદ્ધ નથી. અગાઉ, સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર ૨૨ જાન્યુઆરીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને કેટલાક અન્ય ધારાસભ્યો પાસેથી જવાબ માંગ્યો હતો. ત્યારબાદ કોર્ટે અરજીને બે અઠવાડિયા પછી સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો આદેશ આપ્યો હતો. ઠાકરે જૂથનો આરોપ છે કે શિંદેએ ગેરબંધારણીય રીતે સત્તા કબજે કરી છે અને તે ગેરબંધારણીય સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષ નારવેકરે શિંદે સહિત ૧૬ શાસક કેમ્પના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ઠાકરે જૂથની અરજીને પણ નકારી કાઢી હતી. ૧૦ જાન્યુઆરીએ અયોગ્યતાની અરજીઓ પરના તેમના નિર્ણયમાં, સ્પીકરે કોઈપણ ધારાસભ્યને અયોગ્ય ઠેરવ્યા ન

હતા. નારવેકરે કહ્યું હતું કે કોઈપણ પક્ષનું નેતૃત્વ આંતરિક અસંમતિ અથવા અનુશાસનને દબાવવા માટે બંધારણની ૧૦મી અનુસૂચિ (વિરોધી કાયદો) ની જોગવાઈઓનો ઉપયોગ કરી શકે નહીં. સ્પીકરે કહ્યું હતું કે જૂન ૨૦૨૨માં જ્યારે પાર્ટીનું વિભાજન થયું ત્યારે શિંદે જૂથને પાર્ટીના કુલ ૫૪ ધારાસભ્યોમાંથી ૩૭નું સમર્થન હતું. ચૂંટણી પંચે ૨૦૨૩ ની શરૂઆતમાં શિંદેની આગેવાની હેઠળના જૂથને 'શિવસેના' નામ અને 'ધનુષ અને તીર' લક્ષ્ય સોંપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ દ્વારા પસાર કરાયેલા આદેશોને પડકારતા, ઠાકરે જૂથે તેને સ્પષ્ટપણે ગેરકાયદેસર અને ખોટું ગણાવ્યું અને કહ્યું કે પક્ષપલટાના કૃત્યને સજા કરવાને બદલે, પક્ષપલટોને પુરસ્કાર આપવામાં આવ્યો છે.

## ધરપકડ સામેની હેમંત સોરેનની અરજી પર હાઈકોર્ટે ઈડી પાસેથી જવાબ માંગ્યો

રાંચી,તા.૫  
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડ સામે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની અરજી પર સોમવારે સુનાવણી થઈ. કોર્ટે ઈડીને આ મામલામાં કે ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. હાઈકોર્ટે હવે આ મામલે આગામી સુનાવણી ૧૨ ફેબ્રુઆરીએ કરશે. નોંધનીય છે કે હેમંત સોરેને પોતાની ધરપકડ સામે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, જ્યાં તેને ઝટકો લાગ્યો. સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવા કહ્યું હતું.

અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને આઝાદી મળ્યા પછી આઝાદ ભારતનું પેહલું બજેટ ત્રણ મહિના પછી એટલે કે, ૧૬ નવેમ્બર ૧૯૪૭ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ દેશના પહેલા નાણામંત્રી આર કે શનુભમ ચૈટ્ટોએ રજૂ કર્યું હતું. જેમા તમામ વસ્તુઓ માટે અલગ-અલગ બજેટની જોગવાઈ કરવામાં આવી હતી અને તેમા ટેક્સ સ્લેબની પણ જોગવાઈ કરવામાં આવ્યો હતો, પરંતુ જે સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો, તેની પદ્ધતિ વિચિત્ર હતી. તમને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. આઝાદી પછી પહેલીવાર રજૂ કરવામાં આવેલા બજેટના

ટેક્સ સ્લેબમાં કર્મચારીઓને ૧૫૦૦ રૂપિયા સુધી વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચુકવવો પડતો નહોતો. જો તેનાથી વધારે આવક થાય તો તે ટેક્સ સ્લેબમાં આવતાં હતા. ૧૯૫૮માં જે ટેક્સ સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો, તે ધરના બાળકોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવતો હતો. આ ટેક્સ સ્લેબમાં જો કોઈએ નવા- નવા લગ્ન કર્યા હોય અને કોઈ સંતાન ન હોય તો ૩૦૦૦ રૂપિયા વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લગાવવામાં આવતો નહોતો.

ટેક્સ સ્લેબમાં કર્મચારીઓને ૧૫૦૦ રૂપિયા સુધી વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચુકવવો પડતો નહોતો. જો તેનાથી વધારે આવક થાય તો તે ટેક્સ સ્લેબમાં આવતાં હતા. ૧૯૫૮માં જે ટેક્સ સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો, તે ધરના બાળકોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવતો હતો. આ ટેક્સ સ્લેબમાં જો કોઈએ નવા- નવા લગ્ન કર્યા હોય અને કોઈ સંતાન ન હોય તો ૩૦૦૦ રૂપિયા વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લગાવવામાં આવતો નહોતો.

નવી દિલ્હી, તા. ૦૫  
કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની એક અપીલ કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમને અકવાડિયામાં એક દિવસ તેમની બીમાર પત્ની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપી છે. દિલ્હીની રાઉંડ એવેન્યુ કોર્ટે કહ્યું કે, કસ્ટડી પેરોલમાં તેઓ તેમની પત્ની સાથે મુલાકાત કરી શકશે. મુલાકાત દરમિયાન ડોક્ટર પણ હાજર રહેશે. આ વ્યવસ્થા આગામી આદેશ સુધી જામી રહેશે. કથિત એક્સાઈઝ પોલીસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની ગત વર્ષે ૨૬ ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

તંત્રી લેખ.....

## પૂજાનો અધિકાર

વારાણસીની જિલ્લા અદાલતે જ્ઞાનવાપી પરિસરમાં આવેલ વ્યાસજીના ભોંયરામાં પૂજાની અનુમતિ આપવાનો નિર્ણય આપીને માત્ર ન્યાય જ નથી આપ્યો, પરંતુ એ ભૂલને સુધારવાનું કામ પણ કર્યું, જે ૧૯૮૩માં મુલાયમ સિંહ સરકારે કરી હતી. મુલાયમ સિંહ સરકારે આ ભોંયરામાં પૂજા-પાઠ પર પ્રતિબંધ પૂજાસ્થળ અધિનિયમના અસ્તિત્વમાં આવ્યા છતાં લગાવી દીધો હતો. આ પ્રતિબંધ મનમાન્યો અને ગેરકાયદે તો હતો જ, સાથે જ એક રીતે ૧૯૮૧ના પૂજા સ્થળ અધિનિયમનું શરમજનક ઉલ્લંઘન પણ હતું. આ અધિનિયમ એમ કહે છે કે કોઈ ધાર્મિક સ્થળનું ચરિત્ર બદલવામાં નહીં આવે, પરંતુ તત્કાલીન મુલાયમ સિંહ સરકારે વ્યાસજીના ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ લગાવીને આવું જ કામ કર્યું. મુરઝેલી એ છે કે હિંદુ શ્રદ્ધઘણાઓના પૂજાના અધિકારનું દમન કરનારા આ પ્રતિબંધને હટવામાં ૩૧ વર્ષ થઈ ગયા. વારાણસીની જિલ્લા અદાલતે સાત દિવસની અંદર પૂજાની વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે. આશ્ચર્ય નહીં કે તેને ઉચ્ચતર ન્યાયાલયોમાં પહોંચવામાં આવ્યો. જે પણ હોય, કોઈએ એ માનીને ન ચાલવું જોઈએ કે મંદિર પણ માત્ર આટલાથી સંતુષ્ટ થવાનો છે કે તેને જ્ઞાનવાપી પરિસરના ભોંયરામાં પૂજાનો એ અધિકાર મળી ગયો, જે તેની પાસેથી લગભગ ત્રણ દાયકા પહેલાં છીનવાઈ ગયો હતો. કારણ કે જ્ઞાનવાપી પરિસરના સર્વેશ્વર એટલે કે એએસઆઈ તરફથી જ્ઞાનવાપી પરિસરમાં કરવામાં આવેલ સર્વેશ્વરી એ સાબિત થયું કે ત્યાં મંદિરને તોડીને તેની ઉપર મસ્જિદ ઊભી કરવામાં આવી હતી.

એમ તો એ પહેલેથી જ ઉધાડું સત્ય હતું કે કથિત જ્ઞાનવાપી મસ્જિદ એક મંદિર પર ઊભી કરેલી ઈમારત છે, પરંતુ એએસઆઈના સર્વેએ તેના અકાઠવ પુરાવા આપીને સાબિત પણ કરી દીધું. કોઈ તેને નકારી ન શકે, તેમ છતાં એ જોવું દુઃખદ છે કે મસ્જિદ પણ અને કેટલાય મજહબી અને રાજકીય મુસ્લિમ નેતાઓ એએસઆઈના સર્વે રિપોર્ટને જ નકારી રહ્યા છે! આ તથ્યનો જાણીજોઈને અસ્વીકાર કરવા સિવાય બીજું કશું નથી. મસ્જિદ પણ એવી જ હકધર્મિતા દેખાડી રહ્યો છે, જેવી તેણે અયોધ્યા મામલે દેખાડી હતી. જ્યારે આ એક સર્વમાન્ય અને અકાઠવ પુરાવાથી પ્રમાણિત તથ્ય છે કે મુઘલ શાસકો સહિત અન્ય મુસ્લિમ શાસકોએ મંદિરો તોડીને ત્યાં મસ્જિદો ઊભી કરી દીધી, ત્યારે ન્યાય અને નૈતિકતાનો તકાદો એમ જ કહે છે કે કમ સે કમ એના પર તો દાવો છોડી જ દેવો જોઈએ, જે હિંદુઓ માટે બહુ જ મહત્વ ધરાવે છે.

## અમેરિકા અને બ્રિટને યમનમાં ૩૦થી

### વધુ સ્થાનો પર હુમલો કર્યો, હુતી

### વિદ્રોહીઓના અનેક ઠેકાણાઓ નષ્ટ

વોશિંગ્ટન,તા.૫

યુનાઈટેડ સ્ટેટ્સ અને બ્રિટને શનિવારે યમનમાં હુતી બળવાખોરોની ૩૦થી વધુ જગ્યાઓ પર હુમલો કર્યો. આ હુમલા ઈરાન સમર્થિત જૂથોને સંજોગે કરવા માટે કરવામાં આવી રહ્યા છે. પહેલા, અમેરિકાએ ઈરાક અને સીરિયામાં ઈરાની ચોક્કીઓ પર ડગનબંધ હવાઈ હુમલા કર્યા હતા જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. જોકે, અમેરિકા અને ઈરાને હજુ સુધી મૃત્યુઆંક અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જોઈનમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકાએ આ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. અમેરિકાએ પહેલાથી જ હુમલાને લઈને ચેતવણી જાહેર કરી દીધી હતી. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટ્રલકોમ) અનુસાર, સ્થાનિક સમય અનુસાર તેના દળોએ ઈરાક અને સીરિયામાં આઈઆરજસી કુદૂસ ફોર્સ અને સંલગ્ન મિલિશિયા જૂથો પર હવાઈ હુમલા કર્યા હતા. યુએસ સૈન્ય દળોએ ૮૫થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો હતો, જેમાં યુએસ તરફથી મોકલવામાં આવેલા લાંબા અંતરના બોમ્બર સહિત ઘણા વિમાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

# ટેનટેન આનંદો! હરખ હવે તું હિન્દુસ્તાની!!ભારતમાં પ્રથમવાર ટ્રાન્સજેડર વ્યક્તિ એક બાળકને જન્મ આપશે.

કુદરતે નર અને નારી એવું સર્જન કર્યું. ઈવ અને આદમ જગતના પ્રથમ નર અને નારી હોવાનું કહેવાય છે. અલબત્ત, એ બંને કયાંથી પેદા થયા એનો કોઈ ઉદ્દેશ્ય નથી. પહેલાં મરથી કે પહેલાં ઈડુ એ સવાલ નિરુત્તર છે!! કુદરત ક્યારેક આળસ, ઉતાવળ, કંટાળા કે પ્રમોશન - બોનસ ન મળવાના લીધે ડિફેક્ટિવ પ્રોડક્શન કરે છે. જેમાં નર પણ ન હોય કે નારી પણ ન હોય, શરીરથી નર હોય પણ મનથી નારીભાવ હોય, શરીરથી નારી હોય પણ ભીતરથી ભડ ભાવ્યો હોય. આવા લોકોનું જીવન દોષજન બની જાય છે. (જ્યારે તેમના દેહની અવળચંડી રચના સમજાય છે અને તેને અનુરૂપ જીવવા મથે છે તો સગાઓ, વડાલાઓ માનસિક હુંફ આપવાના બદલે હિટલર બની ડગલે ને પગલે ભમ્પ -એ પણ રમ્પલિંગ-જમ્પલિંગ ભમ્પ ખડા કરે છે.)આવા નમૂના ઘડવા માટેનું ભગવાન શ્વેતપત્ર પણ બહાર પાડતો નથી કે સ્પષ્ટીકરણ નોંધ પણ બહાર પાડતો નથી. સ્વયં પ્રભુ પણ અર્ધનારીશ્વર તરીકે પૂજાય છે. આમ, સેમિનાર ( કોઈ કાર્યક્રમના ફોરમેટની વાત કરતો નથી. પણ ટ્રાન્સજેડરનું ગુજરાતી નામાભિધાન સેમિનારની વાત કરું છું!!!)ભગવાન અર્ધનારીશ્વર જગતના પ્રથમ ટ્રાન્સજેડર હતા. કોઈ શક્ય??

મહાભારતમાં ભીષ્મપિતામહના હુમલાનો પ્રતિકાર કરવા શિખંડીને આગળ કરવામાં આવતા હતા. કેમ કે, શિખંડી એ પૂર્વજન્મમાં સ્ત્રી હતી. એ જમાનામાં ફેમિનાન પાવર કે પુરૂષ સમોવડી સ્ત્રી અગર પુરૂષ અને સ્ત્રી! ખભેખભા મિલાવીને યુધ્ધ કરે તેવી મુહિમ ચાલતી ન હતી. સ્ત્રી પર શસ્ત્રથી પ્રહાર કરવાનું વર્જિત માનવામાં આવતું હતું. જો કે ઘરમાં તુલસીદાસજીની ચોપાઈનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હતો. એ જમાનામાં લોકોને લોકોના આગલા જન્મ સરળતાથી ઉપલબ્ધ કરાવવાની સરળતા અને સુગમતા હતી એ પલ્સ પોઈન્ટ કહેવાય. તમારી પત્ની આગલા જન્મમાં તમારો પતિ તેમ જ સેનાપતિ હોય .તમે તેની ભાર્યા હતા .તમે સુભટ સાથે લફડું કરેલ. પતિ સેનાપતિને જાણ થતાં તમારો શિરચ્છેદ કરેલો. હવે આ જનનમાં તમારા પત્ની પર આગલા ભવનું વેર હપતામાં લઈ શકો. સાલ્વું આપણને ગઈ કાલે રાતે ખીચડી સાથે કઢી ખાધેલી કે છાશ ખાધેલી એ યાદ ન હોય તો આગલા જન્મની ક્યાં માંડો છો????

એમ તો પાંડવના વનવાસના તેરમા એટલે કે ગુપ્તવાસમાં અર્જુન જેવો ધનુર્ધર બુદ્ધનલા નામની ડાન્સ ટિચર બનેલો. જેના પર રાજાનો સાળો કિચક લટૂ થયેલો. (આપણા નાટકોના ગોરવ સમાન અને દંતકથા બનેલા જયશંકર ભોજક એટલે કે સુંદરી પર તે જમાનાના બુદ્ધલ જુવાનિયા લટૂ બનતા. સ્ત્રીઓ તેમની સાડી પહેરવાની ઢબની નકલ કરતી હતી. તેમનું સ્ત્રી સમજ અપહરણ પણ કરવામાં આવેલ!!) જેને સૈરન્દ્રી બનેલ ભીમે યમસદન પહોંચાડેલ!!

૧૯૧૪ માં ડો. રામજી (મરાઠી) વીરક્ષેત્રની કહાનીમાં એક પુરૂષ મોં માં ગુટકા મુકી સ્ત્રી બનતો હતો તેની વાત આલેખી હતી. ટ્રાન્સસેક્સ્યુઆલિઝમમાં પુરૂષને સ્ત્રી બનવાની ઈચ્છા થાય અને સ્ત્રીને પુરૂષ બનવાની. તેમને લાગે કે તેમનું શરીર તો પુરૂષનું છે, પણ તેમનો આત્મા સ્ત્રીનો છે. વિજ્ઞાતીય વ્યક્તિનાં કપડાં પહેરી તેઓ પોતાના પ્રતિબિંબને વિજ્ઞાતીયના વેશમાં જોઈને પોતાની વિજ્ઞાતીય વ્યક્તિ બનવાની વૃત્તિને સંતોષે છે. અવળસવળ વાળના ગૂંચળા જેવી શરીર રચના ઘરાવતા ગે, લેસ્બિયન, શી-મેલ, હીજડા, છક્કા , માશી નામે ઓળખાતો સમુદાયે જંગલે ને પગલે તિરસ્કાર, છેતરપિંડી અને ઘા મળે છે. ઘણીવાર મહિલામાંથી પુરૂષ કે પુરૂષ થવા માટે સર્જરી કરાવે છે. પુરૂષમાંથી સ્ત્રી બનેલી નારી કુદરતી ગર્ભ ધારણ કરી શકતી નથી. એ હોવાનું કબુલ કરવું પણ બહાદુરીનું કામ છે. ભરૂચના રાજવી પરિવારના માનવેન્દ્રસિંહે મર્દાનગી દાખવી ગે હોવાનો ડંકે ક્રી ચોટ ખુલ્લેઆમ જાહેર કરેલ.

આ ગે કપલનો મામલો છે. અમેરિકાના ૨૯ વર્ષીય વેલી સિમ્પસન અને તેના ૨૭ વર્ષીય પાર્ટનર સ્ટીફન ગેથનો કિસ્સો છે. આ ગે કપલ એક કુદરતી રીતે માતા પિતા બન્યા છે. અમેરિકાના વેલી સિમ્પસને થોડા

સમય પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો. તેની અને તેના બાળક સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

થોડા સમય પહેલા તેણે એક ટીવી શોમાં પણ કહ્યું હતું કે હું એક પુરૂષ છું અને મેં એક બાળકને જન્મ આપ્યો છે. વેલી સિમ્પસને કહ્યું કે તેનો જન્મ એક મહિલા તરીકે થયો હતો પરંતુ તે તેના શરીરમાં આરામદાયક ન હોતા. તેથી તે પોતે પુરૂષમાં ફેરવાયો હતો.

ટ્રાન્સજેડર બેનેટે હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. પરંતુ તેમને ફિરિયાદ છે કે તેઓ ગર્ભાવસ્થામાં હતા ત્યારે નર્સ તેમને મોમ કહીને બોલાવતી હતી.

અમેરિકાના લોસ એન્જેલ્સના રહેવાસી ટ્રાન્સજેડર પુરૂષ બેનેટ કાસ્પર વિલિયમ્સ એક બાળકને જન્મ આપ્યો છે. પરંતુ તેમને ફિરિયાદ છે કે જ્યારે તેઓ ગર્ભાવસ્થામાં હતા ત્યારે નર્સ તેમને મોમ કહીને બોલાવતી હતી. આ વાત બેનેટેને પસંદ પડતી ન હતી. બેનેટ કાસ્પર વિલિયમ્સ એક ઈન્ટરવ્યુમાં પુદ્ગા માં બનવાની સ્ત્રી શેર કરી છે.

થોમસ બેટી નામના પુરૂષે એક દાયકા પહેલા બાળકને જન્મ આપવાનો દાવો કરેલ.

હવે ભારત દેશ પણ ટ્રાન્સજેડર કપલ દ્વારા પ્રથમ સંતાનને જન્મ આપવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર છે. સાહેબ સહિત તમામ લોકો દાદા નાના કાકા મામા બનવા જઈ રહ્યા છે. પણ કોઈ ટવિટે કે રિટવિટ કરતા નથી!! હંમેશા ઈવેન્ટ કે ઈલેકશન મોડમાં રહેતા નેતા અને પાર્ટીના પગ કેમ થિરકતા કેમ નથી. તુમ્હારા બચ્ચા ઔર ટ્રાન્સડેડરના બચ્ચા બકરી કા બચ્ચા!??

કેરળના કોઝિકોડમાં એક ટ્રાન્સજેડર કપલ માતા-પિતા બનવાનું છે. દંપતીએ એલાન કર્યું છે કે તેઓ આવતા મહિને માર્યમાં એક બાળકને જન્મ આપશે. દેશમાં આ પહેલો એવો મામલો છે જ્યારે એક ટ્રાન્સ

## આટલા ગંભીર ગુનામાં મામૂલી સજા?

૧૭-૧૮ વર્ષની ઉંમરે બોગસ માર્કશીટના આધારે ઉત્પલ પટેલે મેડિકલમાં પ્રવેશ મેળવ્યો અને ડોક્ટર પણ બની ગયો. હવે તેની ઉંમર ૬૧ વરસની થઈ, આખી જીંદગી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી. હાલે પણ પ્રેક્ટિસ ચાલુ છે ત્યારે ૩૩ વરસ બાદ અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પવનકુમારે તેમને ૩ વર્ષની સજા અને ૧૦,૦૦૦નો દંડ કરેલ છે ! ઉત્પલ પટેલ ધોરણ ૧૨ સાયન્સમાં ૮૦૦માંથી ૩૯૮ માર્ક્સ સાથે ૪૯% એ પાસ થયો હતો. તેને સ્મજમાં એડમિશન મળે તેમ ન હતું. તેથી તેણે ૮૦૦માંથી ૫૪૭ માર્ક્સ, ૬૮% વાળી નકલી માર્કશીટ તૈયાર કરી ૨૮ જુલાઈ ૧૯૮૦ના રોજ ગેરકાયદે રીતે બી.જે.મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. ૭ જુલાઈ ૧૯૮૧માં જ તેની સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ઝ કલમ-૪૨૦/૪૬૮/૪૭૧ હેઠળ ગુનો દાખલ થયો હતો.

થોડાં પ્રશ્નો : ચપુ આપણું ન્યાયતંત્ર કેટલું ગોંઠગાયની ગતિએ ચાલે છે, તેનું આ ઉદાહરણ નથી? જુલાઈ ૧૯૮૧માં ગુનો દાખલ થયો અને ૩૦ જાન્યુઆરી ૨૦૨૪માં ૩૩ વરસે સજા થઈ ! ગુનો થયાના ૪૩ વરસે સજા ! આરોપી અને તેના વકીલે કેસને લાંબાવા અનેક પ્રકારની તારકીઓ કરી, કાયદાની પ્રોસેસનો દુરુપયોગ કરવા જુદા જુદા પ્રકારની અરજી આપી હશે. નીચેની કોર્ટમાં જે અરજી આપે અને તેમાં કોર્ટ જે હુકમ કરે તેમાં અપીલ કે રીવિઝન કરી નીચેની કોર્ટમાં કેસ ન ચાલે તે માટે સ્ટે મેળવેલ હશે. અપીલ કે રીવિઝનમાં જે હુકમ થાય તેની વિરુદ્ધ તેનાથી ઉપરની અદાલતમાં અપીલ કરી ફરીથી સ્ટે મેળવેલ હશે. તેમ કરીને કેસ જેટલો લાંબો ખેંચાય તેટલો ખેંચીને વરસો વરસો કાઢી નાખ્યા હશે. તેમાં પબ્લિક પ્રોસિક્યુટરો અને કોર્ટો પણ જવાબદાર હોઈ શકે. સામાન્ય રીતે આવા અધરા અથવા સજા કરવી પડે તેવા ફોજફારી કેસો ચલાવતા મેજિસ્ટ્રેટો ડરતા હોય છે. તેમાં મહેનત વધુ કરવી પડે. સમય વધુ બગડે. કંઈક ભુલ થાય તો હાઈકોર્ટ તેની વિરુદ્ધ પગલા લેશે તેવો ડર હોય છે. સહેલા કેસોનો નિકાલ જલ્દી થાય તો વધુ સંખ્યામાં કેસોની પતાવટ થાય તો ફટાફટ પ્રમોશન મળે આવા અનેક કારણોસર કોર્ટો અધરા કેસો ચલાવતી

વ્યક્તિ એક બાળકને જન્મ આપશે. છેલ્લાં ત્રણ વર્ષથી સાથે રહેલાં જહાદ અને જિયા પાવલે આ ગુડન્યુઝને શેર કર્યાં છે. જિયા પાવલ એક ડાન્સર છે. તે એક પુરૂષ તરીકે જન્મ્યો હતો. પછી તે એક મહિલામાં બદલાઈ ગઈ. ત્યાં જ, જહાદ એક મહિલા તરીકે જન્મી હતી અને પછી તે પુરૂષ બની ગયો હતો. જહાદે ગર્ભવતી બનવા માટે પોતાના ટ્રાંજિશનિંગ પ્રોસેસને બંધ કરી દીધી છે.

આ લેખ લખતા હતા કે રાજુ રટીએ મારા ઘરમાં એન્ટ્રી મારી. આખો લેખ વાંચ્યો. રાજુ રટીનું મગજ શેતાનની મલ્ટિનેશનલ ફેક્ટરી છે.

“ ગિરધરભાઈ. આ ગરબડ સમાજની કેટલીક વાત પલ્લે ન પડી.”

રાજુ ઉવાચ,

“ રાજુ. સ્ટાર્ટર કે પાવરનો પ્રોબ્લમ હશે!!” મે કહ્યું.  
 “ એવું નથી. તમે એક પ્રશ્ન છે. આવી વિચિત્રો સગર્ભા થાય તો તેને બેભો બમ્પ કહેવાય કે બેભુ બમ્પ? સીમંત કહેવાય કે સીમંતો કહેવાય? તેની સિમંતવિધિ માટે પગલા ભરે કે પગલો ભર્યા કહેવાય?? તેને આશીર્વાદ આપતી વખતે અખંડ સૌભાગ્યવતી કહેવાનું કે અખંડ સૌભાગ્યવતી કહેવાનું? દૂધો નાવો અને કૂખોએ ફલો એમ પણ કહેવાનું ???” રાજુએ પાયાનો પ્રશ્ન પૂછ્યો .

“ રાજુ આ બધાનો આપણને અનુભવ નથી.” એમ કહી છુટકારો મેળવ્યો . “ ગિરધરભાઈ . એક વ્યક્તિ નારીદેહમાં કમ્ફર્ટેબલ ફીલ ન કરે. ફીલ ગુડ કરવા સેક્સ્યેન્જ કરાવી પુરૂષ બંને. પુરૂષ બન્યા પછી ગર્ભવતો થાય. આ સીદી ભાઈના ડાબા કાન જેવું કરે તેના કરતા સ્ત્રી રહેવું શું ખોટું હતું?? “ રાજુએ શુભમન ગિલ જેમ સિક્કસ મારી !!

મારું મોં જહાદ ઊપસેલા ઉદર જેવું સંકોચાઈ ગયો!!!

ભરત વૈષ્ણવ

# એમસીએક્સ પર સોના-ચાંદીમાં સામસામા રાહ: સોનાનો વાયદો

## રૂ. ૩૭૮ ઊંચળ્યો, ચાંદીમાં રૂ. ૪૦૨ની નરમાઈ: ફૂડ તેલ રૂ. ૪૫ ટીલું

મુંબઈ: દેશના અગ્રણી કોમોડિટી રેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે રૂ. ૩૬, ૧૩૮.૬૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. ૬, ૨૭૭.૯૩ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. ૨૯૮૫૬.૭૪ કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨, ૮૩૬ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૬૪, ૧૨૦ અને નીચામાં રૂ. ૬૨, ૫૦૧ ના મથાળે અથડાઈ, રૂ. ૩૭૮ વધી રૂ. ૬૩, ૫૨૮ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૨ ગ્રામદીઠ રૂ. ૨૦૬ થઈ રૂ. ૫૦, ૦૫૫ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ. ૯ થઈ રૂ. ૬, ૧૨૦ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૯ થઈ રૂ. ૬૨, ૪૭૦ના સતરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં ૧ કિલોદીઠ રૂ. ૭૦, ૭૭૬ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૭૧, ૦૩૦ અને નીચામાં રૂ. ૭૦, ૫૮૦ ના મથાળે અથડાઈ, રૂ. ૪૦૨ થઈ રૂ. ૭૦, ૮૦૬ ના સતરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૩૬૧ થઈ રૂ. ૭૦, ૯૩૪ અને ચાંદી-માઈકો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૩૫૧ થઈ રૂ. ૭૦, ૯૩૪ બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ. ૭૨ ૧.૭૫ના ભાવે ખૂલી, રૂ. ૨.૫૦ થઈ રૂ. ૭૧૯.૫૫ જ્યારે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૧.૬૦ થઈ રૂ. ૨૦૦.૧૦ તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૦.૧૫ થઈ રૂ. ૧૮૧ના ભાવ થયા હતા. જસ્ટ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૧.૮૦ થઈ રૂ. ૨.૧૭ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ફેબ્રુઆરી વાયદો ૧ કિલોદીઠ રૂ. ૧.૫૫ થઈ રૂ. ૨૦૦.૪૦ સીસું-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. ૦.૪૦ થઈ રૂ. ૧૮૧.૪૫ જસ્ટ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૧.૭૦ થઈ રૂ. ૨.૧૭ થઈ રૂ. ૨.૧૭ થઈ રૂ. ૭૦.૯૧૯ અને ચાંદી-માઈકો ફેબ્રુઆરી ૧ ટન દીઠ રૂ. ૧, ૧૮૦ વધી રૂ. ૪૭, ૨૦૦ બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ફૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં ૧ બેરલદીઠ રૂ. ૬, ૦૩૩ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૬, ૦૫૪ અને નીચામાં રૂ. ૫, ૯૫૭ ના મથાળે અથડાઈ, રૂ. ૪૫ થઈ રૂ. ૫, ૯૮૫ બોલાયો હતો, જ્યારે ફૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૪૫ થઈ રૂ. ૫, ૯૮૮ બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો ૧ એમએમબીટીયુદીઠ રૂ. ૧૭૪ના ભાવે ખૂલી, રૂ. ૧. ૪૦ વધી રૂ. ૧૭૫. ૭૦ અને નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો ૧. ૪ વધી ૧૭૫. ૫ બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં ૧ ખાંડીદીઠ રૂ. ૫૭, ૪૨૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૫૭, ૯૦૦ અને નીચામાં રૂ. ૫૭, ૪૨૦ ના મથાળે અથડાઈ, રૂ. ૪૦ થઈ રૂ. ૫૭, ૭૦૦ના સતરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ. ૧. ૬૦ થઈ રૂ. ૯૧૧. ૨૦ બોલાયો હતો.

કામકાજની દૈનિકે એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૨, ૧૯૩.૦૨ કરોડનાં અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૨, ૪૧૩.૬૭ કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ફૂડ તેલ અને ફૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ. ૫૩૧. ૨૫ કરોડનાં ૧૭, ૩૪૮ લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ. ૪૨૪.૦૧ કરોડનાં ૨૬, ૪૮૫ લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ. ૯૩. ૭૨ કરોડનાં ૧, ૫૦૦ લોટ સીસું અને સીસું-મિની વાયદાઓમાં રૂ. ૧૩. ૭૮ કરોડનાં ૨૪૩ લોટ તાંબાના વાયદાઓમાં રૂ. ૩૭૩. ૦૧ કરોડનાં ૨, ૦૬૯ લોટ અને જસ્ટ તથા જસ્ટ-મિની વાયદાઓમાં રૂ. ૨૨૪. ૮૬ કરોડનાં ૩, ૪૩૪ લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ. ૬. ૩૭ કરોડનાં ૨૩ લોટ

મેન્થા તેલ વાયદામાં રૂ. ૪. ૨૩ કરોડનાં ૧૨૮ લોટનાં કામકાજ થયાં હતાં.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર ભુલડેક્સ વાયદામાં રૂ. ૪. ૦૧ કરોડનાં ૫૦ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરસ્ટેટ ભુલડેક્સ વાયદામાં ૨૯૭ લોટના સતરે રહ્યો હતો. ભુલડેક્સ ફેબ્રુઆરી વાયદો ૧૬, ૦૫૫ પોઈન્ટ ખૂલી, ઉપરમાં ૧૬, ૦૭૮ અને નીચામાં ૧૬, ૦૧૭ બોલાઈ, ૬ ૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૬૨ પોઈન્ટ થઈ ૧૬, ૦૪૫ પોઈન્ટના સતરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. ૨૯૮૫૬. ૭૪ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ફૂડ તેલ ફેબ્રુઆરી રૂ. ૬, ૦૦૦ સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ. ૧૬૯ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. ૧૩૭. ૬૦ ના મથાળે અથડાઈ, રૂ. ૧૯. ૩૦ થઈ રૂ. ૧૪૯. ૭૦ થયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. ૧૮૦ સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ ૧ એમએમબીટીયુદીઠ રૂ. ૮. ૮૫ ખૂલી, ઉપરમાં રૂ. ૮. ૮૫ અને નીચામાં રૂ. ૭. ૯૦ રહી, અંતે રૂ. ૦. ૧૦ થઈ રૂ. ૮. ૪૦ થયો હતો.

સોનું માર્ચ રૂ. ૬૩, ૦૦૦ સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬



# પાટણના સુજનીપુર નજીકથી ત્યજી દીધેલ હાલતમાં બાળકી મળી આવી સ્થાનિક લોકોમાં ફિટકારની લાગણી સાથે રોષ



પાટણ શહેરની અંદર આવેલ સુજનીપુર પાસેના સુર્યનગર નજીક ના કિખા રો હાઉસના ગેટ નજીકથી એક બેટૂત ને વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે પોતાના ખેતરે જઈ રહ્યા હતા તે દરમિયાન ત્યજી દીધેલ હાલતમાં બાળકી મળી આવતા ખેટૂત દ્વારા તાત્કાલિક પોતાની બહેન સહીત આજુ બાજુના રહીશોને જાણ કરાતા તુરંત જ લોકોના ટોળે ટાળા એકઠા થઈ જવા પામ્યા હતા તેમજ ૧૦૮

તેમજ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનને જાણ કરવામાં આવી હતી તેમજ ઘટનાની જાણ ૧૦૮ ને થતા પાયલોટ ગુલાબ ખાન તેમજ ઈ. એમ .ટી પુજા બેન ગોસ્વામી દ્વારા ઘટના સ્થળે દોડી આવી બાળકી ને ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે ઓકિસજન સહીતની સ્થળ પર જ સારવાર આપી પાટણ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી ગુજરાત સરકાર દ્વારા એક

બાજુ બેટી બચાઓ બેટી પદાઓ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમજ બાળકીઓ માટે વ્હાલી દીકરી સહીતની યોજનાઓ બહાર પાડી મહિલાઓ ને પ્રોત્સાહીત કરી રહી છે ત્યારે કેટલાક નિષ્ઠુર લોકો પોતાના પાપ છુપાવવા તાજા જન્મેલ બાળકોને રસ્તા પર જ જાહેરમાં ફેંકી દેવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના આજરોજ પાટણ ખાતે બનવા પામી હતી જેમાં સુજનીપુર નજીક આવેલ

કિખા રો હાઉસના ગેટ નજીકથી વહેલી સવારે ધીરજ ભાઈ ભીલ નામના એક ખેટૂત પોતાના ખેતર જઈ રહ્યા હતા તે દરમિયાન ત્યજી દીધેલ હાલતમાં બાળકી નજરે પડતા તેઓ દ્વારા પોતાની બહેન સહીત આજુ બાજુના રહીશોને જાણ કરાતા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ ૧૦૮ ને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી તાત્કાલિક ઓકિસજન સહિતની સારવાર આપી પાટણ સીવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યા હાજર તબીબો દ્વારા બાળકીનું મેડિકલ ચેક કરી આઈ સી યુ મા દાખલ કરાઈ હોવાનું જાણવા મળ્યા હતા તેમજ પોલિસ સહીતનો આરોગ્ય અધિકારી ઓનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું

### બાળકી ચારથી પાચ દિવસની હોવાનું અનુમાન

સ્થળ પર પહોંચી બાળકીને સારવાર આપનાર ૧૦૮ ઈમરજન્સી ના સ્ટાફ સાથે ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક દ્વારા

ટેલિફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે બાળકી ચારથી પાંચ દિવસની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમજ બાળકી વહેલી સવારે મળી આવી હતી તે દરમિયાન બાળકી પર અસંખ્ય કીડીઓ ચોંટેલી હોય ૧૦૮ ના ઈ એમ ટી પુજાબેન ગોસ્વામી દ્વારા બાળકી પર ચોટી રહેલી કીડીઓ ને દૂર કરીને તાત્કાલિક ઓકિસજન આપવામાં આવ્યું હતું તેમજ પાટણ ખાતે લાવવામાં આવી હતી .

### સ્થાનિક રહીશોએ માનવતા મહેકાવી .

.વહેલી સવારે ત્યાંથી પસાર થતા ખેટૂતને ત્યજી દેવાયેલી હાલતમાં બાળકી મળી આવતા તાત્કાલિક તેઓ દ્વારા પોતાની બહેન સહિત આજુબાજુના લોકોને જાણ કરતાં તાત્કાલિક આજુબાજુના લોકો સહિત મહિલાઓ પણ એકઠી થઈ જવા પામી હતી અને મહિલાઓ દ્વારા બાળકીને માતાની હુંફ આપીને તંત્રને જાણ કરી હતી . નિખિલ જોષી : પાટણ જિલ્લા બ્યુરોચીફ



અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા કવિ સંમેલન રવિવારે યોજાઈ ગયું. જેમાં ડૉ. સતીન દેસાઈ, પરવેઝ દીપ્તિ ગુરુ ખુબજ સરસ અભિવ્યક્તિ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

## છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ: ધાયણોજ જહું માતાજી મંદિર પરિસરમાં ભક્તિસભર ઉજવણી કરવામાં આવી



પાટણ સમીપ આવેલા ધાયણોજના જહું માતાજી મંદિર પરિસરનો સોમવારના શુભદિને છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે શ્રી જહું માતાજીના મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે માતાજીની ભવયાતી ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી. જે પાલખી યાત્રામાં સમસ્ત ધાયણોજ ગામના ગ્રામજનો સહિત દૂર દૂરથી પધારેલા મોટી સંખ્યામાં શ્રી જહું માતાજીના ભક્તજનોએ જોડાઈને માતાજીનો જય જય

કાર કરતા સમગ્ર વાતાવરણ શ્રી જહું માતાજીના રંગે રંગાઈ જવા પામ્યો હતો આ પાલખીયાત્રા સમગ્ર ધાયણોજ ગામમાં ફરી નિજ મંદિરે સંપન્ન બની હતી આ પ્રસંગે મંદિર પરિસર આયોજિત સમૂહ યજ્ઞમાં વિવિધ યજ્ઞમાન પરિવારોએ ભૂદેવો ના મંત્રોચાર વચ્ચે આહુતિ અર્પિત કરી માતાજીને અન્નહુટ નો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને શ્રી જહું માતાજીની મંગલા આરતી કરવામાં આવી હતી માતાજીના રૂડા આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી જહું માતાજીના મંદિર પરિસર ખાતે

યોજાયેલા માતાજીના છઠ્ઠા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે દેવ દરબાર જાગીર મઢના શ્રી ઓગડ મંદત ૧૦૦૮ ધર્મ ધુરંધર બળદેવ નાથજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી ભાવિક ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી ધાયણોજના જહું માતાજી મંદિર પરિસરના છઠ્ઠા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી જહું માતાજીના છઠ્ઠા વાર્ષિક પાટોત્સવ ને યાદગાર બનાવવા શ્રી જહું માતા દેવસ્થાન ધાયણોજના પ્રમુખ રેવાભાઈ દેસાઈ તેમજ મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણીયા સહિત સમગ્ર સ્થૂળગણ ધાયણોજ ગામના ગ્રામજનો, સેવાભાવી યુવાનો સહિત જહું માતાજીના ભક્તોએ ભારે જલ્મત ઉઘવી પ્રસંગે સફળ બનાવ્યો હતો નિખિલ જોષી : પાટણ જિલ્લા બ્યુરોચીફ

# ગણપત યુનિવર્સિટી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને તેના અમલીકરણ વિષે વર્કશોપનું આયોજન

તા. ૫ ફેબ્રુ, ૨૦૨૪ ને શનિવારે એજ્યુકેશન પોલિસી - ૨૦૨૦: ઈમ્પ્લિમેન્ટેશન એટ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશનના કેન્દ્રવર્તી વિચાર સાથે ગણપત યુનિવર્સિટીના આંગણે તાજેતરમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાના કળસ્વરૂપે રાષ્ટ્રીય શિક્ષણનીતિનું વિવિધ શૈક્ષણિક-સંસ્થાઓમાં કરી રીતે તેનો અસરકારક અમલ થઈ શકે તે વિષેની અર્થપૂર્ણ ચર્ચા અને સંભવિત સામુહિક પ્રયાસોની શક્યતાઓને એક ઉત્તમ મંચ સાંપડ્યો હતો. આ કાર્યશાળાએ સર્વગ્રાહી શિક્ષણનું મહત્વ, જટિલ વૈચારિક મનોમંથન, સર્જનાત્મકતા અને સમસ્યાઓના ઉકેલ શોધી આપતી કુશળતા જેવા મુદ્દાઓને ઉજાગર કાર્ય હતા. આ વર્કશોપ



(કાર્યશાળા)માં ગણપત યુનિવર્સિટીના અભ્યાસુ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આમંત્રિત મેહમાનો ઉપરાંત પણ ૨૦૦ જેટલા શિક્ષણધર્મીઓએ ભાગ લીધો હતો. ગણપત યુનિ.ના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપત દાદા અને ટ્રસ્ટી શ્રી બહેચરભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. શ્રી મહેન્દ્ર શર્માએ ભારતને વૈશ્વિક ઓનલેજ સુપર પાવર બનાવવા, વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય ઘડતર કરવા, ખરા અર્થમાં 'ગ્લોબલ સિટિઝન' બનાવવા, કૌશલ્યનું ઘડતર કરવા માટે આ શિક્ષણ નીતિ કેવી રીતે સક્ષમ છે

તેની વિષે વિશદ છણાવટ કરી હતી. 'શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ' ના રાષ્ટ્રીય સચિવ માનનીય ડૉ. શ્રી અતુલ કોઠારીજીએ શિક્ષણ નીતિ વિષે ભારે ઉડાણ પૂર્વક ચર્ચા કરી હતી અને તેની લવચીકતા, વિવિધ જ્ઞાન-શાખાઓના અભ્યાસનો અભિગમ, મૂલ્યવર્ધિત અભ્યાસક્રમો, ભારતીય જ્ઞાન-પરંપરાને જાણવા સમજવાની અને તેનો અભ્યાસ કરવાની વ્યવસ્થા સહિત અનેકવિધ મુદ્દાઓ સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. શ્રી ભાગ્યેશ જહા ગુજરાત સાહિત્ય અકાદમીના મુદ્યામત ડૉ. શ્રી જયેન્દ્રસિંહ જાદવ, પીએપીએલ અને એઆઈક્યુના ડાયરેક્ટર ડૉ. પરેશ

કારિયા, આઈઆઈટી અલ્લાબાદના ડાયરેક્ટર ડૉ. મુકુલ સુતોન, સીઓઈપીટેકનોલોજીકલ યુનિવર્સિટીના પ્રો. ડૉ. વિભા વ્યાસ સહિતના વિદ્વાન નિષ્ણાતોએ પણ યોગદાન આપ્યું હતું. આ કાર્યશાળાનું કો-ઓર્ડિનેશન ડૉ. શ્રી અજય ગુમાએ કર્યું હતું.

NOG સાહિત્ય સરિતા ગ્રુપ સ્પર્ધા 28/1/2024

ગદ્ય પ્રથમ ગીતા સાંઘાર

પદ્ય પ્રથમ દેવેન્દ્ર જોષી

ગદ્ય દ્વિતીય દિલીપ સોની

પદ્ય દ્વિતીય દિલીપ ઘોળકિયા

ગદ્ય તૃતીય ભરત સાંગાણી

પદ્ય તૃતીય યોગેશ પંડ્યા

# દેશી કુળની ગાયનું દૂધ પીવાના ફાયદા

પ્રાચીન કાળથી ગાયનો મહિમા અપરંપાર છે કહેવાતું હતું કે આપણા દેશમાં ગંગાઓ વહેતી હતી. ગાયનું દુધ અનમોલ તો હોય જ છે પણ તેમાં પણ ગીર ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે. પણ આધુનીકીકરણને કારણે સાત્વિકતા ઘટતી જાય છે ને ગાયોની ઉપેક્ષા વધતી જાય છે. વેદપુરાણોમાં ગાયને કામધેનું કહેવાય છે કેમ કે તે મરે ત્યાં સુધી દૂધ આપતી રહે છે. ગાયનાં દૂધનાં અનેક ફાયદાઓ છે જેનો આધાર પણ વૈજ્ઞાનિક છે.



શરીર ને તંદુરસ્ત શરીર ત્યારે કહેવામાં આવે છે જો તમારું હાડપિંજર રોજ-બ-રોજ કાર્ય કરે. હાડપિંજર ને કેલ્શિયમને પસંદ છે! અને દૂધ કેલ્શિયમ નો અત્યંત સમૃદ્ધ સ્ત્રોત છે, તમારા દાંતને કેલ્શિયમની જરૂર છે. દૂધના કપમાં ૨૭૬ - ૩૦૦ મિલિગ્રામ (એમજી) કેલ્શિયમ છે. દૈનિક ધોરણે પુરુષો/સ્ત્રીઓમાં ૧૦૦૦ એમજી કેલ્શિયમ હોવું જોઈએ. ૪. મગજ શક્તિ વધે છે સંશોધન બતાવે છે કે દૂધ મગજના જ્ઞાનાત્મક કાર્યને સુધારે છે. દૂધ વિટામિન બી ૧૨ નો સ્રોત છે, તેમાં બી ૧૨ સારા એવા પ્રમાણમાં હોય છે આમ દૂધ શાકાહારી લોકો માટે વરદાન છે. મગજની શક્તિ અને જ્ઞાનાત્મક કાર્ય માટે વિટામિન બી ૧૨ આવશ્યક છે, તે અલ્ટાઈમર રોગને અટકાવવામાં મદદ કરે છે. તમારા મગજ માટે, કૃપા કરીને દૈનિક ઓછામાં ઓછું ૧ કપ દૂધ પીવો!

૫. હાર્ટ એટેકથી બચાવે છે ગાય ઓમેગા -૩ ફેટી એસિડનું ઊંચું મૂલ્ય ધરાવે છે. ઓમેગા ૩ એચડીએલ (કૉલેસ્ટ્રોલ) કોલેસ્ટ્રોલ વધારે છે જે 'સારા' કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે. ઓમેગા ૩ હાનિકારક રક્ત ગંદાઈ જવાથી અટકાવે છે. ઓમેગા -૩ હાઈબ્લડ પ્રેશરવાળા લોકોના બ્લડ પ્રેશર સ્તર ઘટાડે છે. ટૂંકમાં, દૂધમાં આવા તત્વો છે જે હૃદય માટે ખૂબ જ સારા છે. ૬. એસીડીટી મટાડે છે ગાયના દૂધમાં ઓમેગા ૩, એન્ટીઓક્સિડન્ટ સંયોજનો અને પ્રોટીન જેવા પદાર્થો છે જે એસીડીટી મટાડે છે. ૭. શરીર ની ચરબી ઘટાડે છે (વજન) દૂધમાં લિનોલીક એસિડ (સીએલએ) છે જે શરીરમાં ચરબી બાળે છે. ડેરી કેલ્શિયમ પણ શરીરમાં વજન ઘટાડે છે. દૂધમાં વિટામીન ડી હોય છે, જે ચરબીને બાળવામાં મદદ કરે છે. ૮. કેન્સર નું જોખમ

ઘટાડે છે દૂધમાં એન્ટિ-કેન્સર એ જન્ટો હોય છે જે કેન્સર કોશિકાઓના વિકાસને અટકાવે છે. કેટલાક સંશોધન સૂચવે છે કે દૂધનો નિયમિત વપરાશ કેન્સર અટકાવે છે. ઓટોગો યુનિવર્સિટીનું સંશોધન અને તેના પરિણામ કહે છે કે દૂધના દૈનિક વપરાશથી આંતરડાના કેન્સરનું જોખમ ૩૦% જેટલું ઓછું થઈ ગયું છે. ઘણા અભ્યાસોએ જણાવ્યું છે કે ઓછી ચરબીવાળા દૂધથી અંડાશયના કેન્સરનું જોખમ ઓછું થયું છે. દૂધમાં રહેલું સીએલએ-કન્જેજ્યુટેડ લિનોલીક એસિડ એન્ટી કેન્સર એજન્ટ માટે જાણીતું છે. ૯. ત્વચાનો મિત્ર પ્રાચીન સમયથી સ્ત્રીઓ ચમકતી ચામડી માટે દૂધનો ઉપયોગ કરે છે, આજ ના સમય મા પણ લોકો હળદરની પેસ્ટ અને દૂધ ને ચેહરા પાર ચમકતી ચામડી માટે લગાવે છે. પ્રાચીન સમયમાં રાણીઓ અને અન્ય ઉજવણી કરનારા મહિલાઓ દૂધ થી સ્નાન કરતી! દૂધ તેમની સુંદરતા માટે જવાબદાર હતું. દૂધમાં લેક્ટિક એસિડ મૃત ત્વચા દૂર કરે છે. ૧૦. મેમરી, શક્તિ અને બુદ્ધિ આયુર્વેદ અનુસાર ગાયના દૂધમાં ઓજ (શક્તિ) વધારવા નું શ્રેષ્ઠ દ્રવ્ય છે. સારા આરોગ્ય અને યાદશક્તિ માટે ગાય દૂધ શ્રેષ્ઠ છે. ગાયનું દૂધ મગજ ના એવા પ્રદેશો વિકસાવવા માટે મદદ કરે છે જે મેમરી અને બુદ્ધિ માટે જવાબદાર છે.